



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય

આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ- ૩૮૮૦૦૧



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા આયોજીત

પરિસંવાદ

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા મહાવિદ્યાલય ખાતે 'ફર્ટિલીટી મેનેજમેન્ટ ઇન બોવાઇન્સ' વિષય પર પરિસંવાદ(સેમિનાર)નું તા. ૨૧/૦૯/૨૦૧૮ નાં કપિલા હોલ ખાતે આયોજન થયેલ હતું. પરિસંવાદની શરૂઆતમાં દિપ પ્રાગટ્ય એવં પ્રાર્થનાગીત પછી પધારેલ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ એવં સ્મૃતિચિન્હ આપ્યા બાદ મહાવિદ્યાલયનાં ડીનશ્રી, ડો. એ. એમ. ઠાકર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. તેઓએ પોતાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ તરીકેનાં પદેથી પરિષદનાં વિવિધ કાર્યલક્ષી કાર્યોની તલસ્પર્શી માહિતી આપી, મહાવિદ્યાલયનાં શૈક્ષણિક, સંશોધન એવં વિસ્તરણની પ્રગતિનો વિશદ ચિતાર આપેલ હતો. સમારંભનાં પ્રમુખ સ્થાને બિરાજેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો.એન.સી.પટેલ સાહેબ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘનાં ઉપસ્થિત સભ્યોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ બિરદાવી, આ પ્રકારનાં પરિસંવાદનું માહાત્મ્ય સમજાવી, વધુ ને વધુ ગુણવત્તા સભર શૈક્ષણિક સામર્થ્ય વિકસાવવામાં સહકારિત થવા પ્રોત્સાહિત કરેલ હતાં એવં આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વિકાસપથનો ઉપસ્થિત વૈજ્ઞાનિકો સમક્ષ સમગ્રતયા તાદશ્ય આલેખન કરી, તેમાં સહભાગી થવા જણાવેલ હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્યનાં પશુપાલન નિયામકશ્રી ના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ સંયુક્ત નિયામકશ્રી, પશુપાલન ખાતુ, વડોદરા જિલ્લાનાં ડો. એન. કે. રોહિત દ્વારા પોતે પણ આ માતૃસંસ્થાનાં શૈક્ષણિક માનસપુત્ર છે એમ જણાવી પશુપાલન ક્ષેત્રે પશુઓની ફળદ્રુપતા વધારવાનાં હાથ ધરેલ પ્રયાસોની દ્રષ્ટિકૃત માહિતી આપી, ઉપસ્થિત વૈજ્ઞાનિકોને વધુ ને વધુ સંશોધન કરવા પ્રોત્સાહિત કરેલ હતાં. અતિથિ વિશેષ તરીકે પધારેલ કામઘેનુ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો. પી. એચ. વાટલિયાએ પોતાનાં મહાવિદ્યાલયનાં પશુ ફળદ્રુપતાનાં સંશોધનની વિસ્તૃત માહિતી આપી હતી. અન્ય અતિથિ વિશેષ તરીકે પધારેલ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો. એચ. એન. ખેર દ્વારા પશુચિકિત્સકોની અન્ય ક્ષેત્રોમાં માહાત્મ્ય અંગેની માહિતી પોતાનાં સ્વદ્રષ્ટાંત દ્વારા આપેલ હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડો. કે. બી. કથીરિયા દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પશુપાલન

ક્ષેત્રે પશુઓની ફળદ્રુપતા વધારવાનાં થયેલ સંશોધનો અને આયોજનોની મુદ્દાસર છણાવટ કરી તલસ્પર્શી માહિતી ઉપસ્થિત વૈજ્ઞાનિકોને આપેલ હતી. ચીફ જનરલ મેનેજર, માર્કેટિંગ, આઇઓસી, વડોદરાનાં શ્રી અનિલ ફક્રેજાએ તેમનાં કોર્પોરેટ સોશિયલ ડેવલપમેન્ટ મહાવિદ્યાલયનાં ક્લિનીક્સ ડિપાર્ટમેન્ટ માટે માતબર અનુદાન આપવાની જાહેરાત કરેલ હતી. આ પ્રસંગે ગુજરાત વેટેરીનરી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત જીવીસી ન્યૂઝ લિંકનું પણ વિમોચન થયેલ હતું. પરિસંવાદમાં પશુપાલન ક્ષેત્રે પશુફળદ્રુપતા વધારવા માટેનાં વૈજ્ઞાનિક અભિગમો આયામોનું માર્ગદર્શન આપતા પ્રવચનો યોજાયેલ હતા. ઉપરોક્ત પરિસંવાદ સંકલિત તા. ૨૦/૦૯/૨૦૧૮નાં રોજ યોજાયેલ વ્યાવસાયિક નિર્ભરતા થકી સ્વાવલંબન પ્રાપ્તિ ક્ષેત્રે સ્વબળે વ્યાવસાયિક નિર્ભરતા પ્રાપ્ત કરેલ વિષય નિષ્ણાતો દ્વારા અંતિમ વર્ષનાં સ્નાતક એવં અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને શિક્ષકગણો માટે માર્ગદર્શિય પ્રવચનોનું આયોજન પણ કરવામાં આવેલ હતું. સમગ્ર પરિસંવાદનું સંચાલન ડો. એમ. ટી. પંચાલ, પ્રાધ્યાપકશ્રી, ગાયનેકોલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. પરિસંવાદની આભાર વિધિ ડો. આર. એસ. જોષી, પ્રાધ્યાપક, જીનેટીક્સ વિભાગ અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ/સમારંભમાં બહોળી સંખ્યામાં મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓ, અધિકારીશ્રીઓ એવં કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતાં. પરિસંવાદની પૂર્ણાહૂતિ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવેલ હતી.





પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા આયોજીત પરિસંવાદ